



કોવિડ-19 વેતન સબસિડી ઓગસ્ટ 2021

આ માહિતી ફક્ત માર્ગદર્શન માટે છે. વર્ક એન્ડ ઇન્કમ વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલ વેતન સબસિડીમાં, પાત્રતાના માપદંડ અને જવાબદારીઓની સંપૂર્ણ વિગતો છે તથા તે અન્ય કોઈપણ માહિતી ઉપરવટ લાગુ પડશે.

- કોવિડ-19 વેતન સબસિડી ઓગસ્ટ 2021 એ સમગ્ર ન્યૂઝીલેન્ડના રોજગારદાતાઓને સમર્થન પૂરું પાડવા માટેની ચૂકવણી છે, જેથી કરીને તેઓ તેમના કર્મચારીઓને ચૂકવણી કરવાનું ચાલુ રાખી શકે અને 17 ઓગસ્ટ, 2021થી એલર્ટ લેવલ 3 અને 4 ચાલુ રહેવાથી અને કોવિડ -19 મહામારી આવી ત્યારથી કોવિડ સુરક્ષા ફેમવર્ક ચાલુ રહેવાથી પ્રભાવિત થયેલા વ્યવસાયોની નોકરીઓ બચાવી શકે.
- વેતન સબસિડી ઓગસ્ટ 2021ની ચૂકવણી પ્રત્યેક પૂર્ણકાલિન કર્મચારીઓ માટે પ્રતિ સપ્તાહ \$600ના દરે બે વખતની ચૂકવણીમાં કરાઈકરાઈ છે અને પ્રત્યેક અંશકાલિક કર્મચારીઓ માટે પ્રતિ સપ્તાહ \$359ના દરે કરાઈકરાઈ છે.
- આજ સુધીમાં સાત વેતન સબસિડીની ચૂકવણીઓ કરાઈ છે.
- પ્રત્યેક રાઉન્ડમાં નવી અરજી કરવાની હોય છે અને વ્યવસાયોએ એવી ખાતરી કરવી જરૂરી છે કે પ્રત્યેક અરજી માટે તેઓ પાત્રતાના માપદંડ પૂરા કરે.
- જો તમે અગાઉની વેતન સબસિડી માટે અરજી કરી હોય તો, વેતન સબસિડી #8 માટે તમે તમારી છેલ્લી અરજીના બે અઠવાડિયા પછી જ અરજી કરી શકો છો. આમ, જો તમે ગુરૂવાર, 25 નવેમ્બરના રોજ અરજી કરી હોય તો, તમે વેતન સબસિડી #8 માટેની અરજી ગુરૂવાર, 9 ડિસેમ્બર રોજ કરી શકો છો. વહેલી અરજીઓ સ્વીકારી શકાશે નહીં. તમે અરજી કરો તે પહેલા તમારે ચૂકવણીના બે અઠવાડિયા પૂરા થાય ત્યાં સુધી રાહ જોવી જરૂરી છે.
- જો તમે અગાઉની સબસિડી માટે અરજી કરી ન હોય તો હજુ પણ તમે તમારા દ્વારા પાત્રતાના તમામ માપદંડો પૂરાં કરવામાં આવે છે એ શરતે શુક્રવાર, 26 નવેમ્બરથી સબસિડી #8 માટે હજુ પણ અરજી કરી શકો છો.

- વર્ક એન્ડ ઇન્કમ વેબસાઇટ, www.workandincome.govt.nz/wagesubsidy મારફતે અરજીઓ કરી શકાય છે.
- તમારી અરજીઓ પર શક્ય એટલી વહેલી તકે પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેની ખાતરી માટે તમારી અરજીમાં પૂરી પાડવામાં આવેલી માહિતી ઇનલેન્ડ રેવન્યૂ પાસે રહેલી માહિતી (જેમ કે, આઇઆર નંબર, નામ, બેંક ખાતું, કર્મચારીના નામ અને આઇઆર નંબર સહિતની વિગતો) સાથે મેળ ખાય તે મહત્વપૂર્ણ છે.
- તમારે ચકાસવાનું રહેશે કે, તમે યોગ્ય ચૂકવણી માટે અરજી કરી રહ્યા છો. કેટલાક વ્યવસાયોએ જ્યારે કોવિડ-19 વેતન સબસિડી ઓગસ્ટ 2021 માટે અરજી કરવા માંગતા હોય ત્યારે, તેમણે લીવ સપોર્ટ સ્કીમ કે શોર્ટ ટર્મ એબસેન્સ પેમેન્ટ માટે અરજી કરી છે. (વ્યવસાયો કોઈ એક સમયે એક કર્મચારી માટે કોવિડ-19ની આ ત્રણ ચૂકવણીઓમાંથી ફક્ત એક જ ચૂકવણી મેળવી શકે છે.)

પાત્રતાના માપદંડ

- તમે જેની સાથે સંમત થઈ રહ્યાં છો, તે જાહેરનામા સહિત તમામ માહિતી તમે કાળજીપૂર્વક વાંચો તે મહત્વપૂર્ણ છે અને ખાતરી રાખો કે તમે તેનું અનુપાલન કરો છો.
- રેવન્યૂ ટેસ્ટમાં ઓછામાં ઓછા 40%નો ઘટાડો છે. તેનો અર્થ એ થયો કે:
 - 23 નવેમ્બર થી 6 ડિસેમ્બર સુધીના 14 દિવસમાં તમારા વ્યવસાયની આવક ઓછામાં ઓછી 40% નીચી ગઈ હોવી જોઈએ (અથવા નીચે જવાની ધારણા છે), એલર્ટના લેવલમાં વધારો કરવામાં આવ્યાના તરત પહેલાના છ અઠવાડિયામાં 14 દિવસના વિશિષ્ટ સમયગાળા દરમિયાનની તેમની આવકની સાથે સરખામણી કરવામાં આવે ત્યારે.
 - એકદમ મોસમી આવક સાથેનો વ્યવસાય તેમની 2020 કે 2019 ની આવકની એ જ સમયગાળા સાથે તુલના કરી શકે છે, જો તેઓ તુલના ડિફ્રેલ્ટ સમયગાળાનો ઉપયોગ કરીને બતાવી શકે કે તેમનો મોસમી પ્રકારનો વ્યવસાય તેમના માટે રેવન્યૂ ટેસ્ટને પહોંચી વળવાનું વધુ મુશ્કેલ બનાવે છે.
- આવકમાં ઘટાડા ટેસ્ટની ગણતરી તમારો વ્યવસાય સંપૂર્ણ અથવા આંશિક રીતે હવામાન પર નિર્ભર છે અથવા કોવિડ-19 સુરક્ષા ફેમવર્કના એલર્ટ સ્તર 3 માંથી પસાર થતા હોય તેવા વિસ્તારમાં આવેલો નથી તેના આધારે કરવામાં આવે છે. વધુ વિગતો માટે ઘોષણા જુઓ.

ચૂકવણી થઈ ગયા બાદ

- જો તમારા બિઝનેસની આવકમાં ઘટાડો ન થાય તો, તમારે સબસિડી પરત ચૂકવી દેવાની રહેશે.
- તમારા વ્યવસાયે તમારા ઘોષણાપત્રના સમર્થનમાં પુરાવાઓને તૈયાર કરવાના અને પોતાની પાસે રાખવાના રહેશે (પરંતુ તમારે આ પુરાવા અરજીની સાથે પૂરાં પાડવાની જરૂર નથી).
- એમએસડી પૃષ્ઠભૂમિની ચકાસણી અને ટાર્ગેટ ઇન્ટેગ્રિટી એક્ટિવિટી પૂરી કરશે. તેનો અર્થ એ છે કે, અરજીકર્તાઓ પાસેથી આવકમાં ઘટાડો થયાની સાબિતીનું એક સેમ્પલ માંગવામાં આવશે.